

મધ્યાહન ભોજન અઠવાડિક મેનુ



વાર	પ્રથમ ભોજન	નાસ્તો
સોમવાર	વેજિટેબલ ખીચડી	સુખડી
મંગળવાર	ફાડા લાપત્તી અથવા મુઠીયા અને શાક	કઠોળ ચાટ
બુધવાર	વેજિટેબલ પુલાવ	મિઠ્ઠા દાળ
ગુરુવાર	દાળ ઢોકળી	કઠોળ ચાટ
શુક્રવાર	દાળ-ભાત	મુઠીયા
શનિવાર	વેજિટેબલ પુલાવ	કઠોળ ચાટ

